

વિશ્વેષण • દેશમાં માત્ર 5% ઘરેલું વીજ વપરાશકારોએ રૂફ્ટોપ સોલરની ઈચ્છા બતાવી છે

સૌર ઊર્જાના પારંપરિક મોડલ્સથી આગળ વિચારવું પડશે



ભાવના ત્યાગી

પ્રોગ્રામ એસોસિએટ, કાઉન્સિલ ઓન
અનર્જી, એનવાયનમેન્ટ એન્ડ વોટર

ભારત અક્ષય ઊર્જાનો ઉપયોગ વધારવા માટે એક કરોડ ઘરની છત પર સોલર પેનલ લગાવવા માગે છે. તાજેતરમાં જ પીએમ સૂર્યોદય યોજનાની જહેરાત થઈ છે, જેનું લક્ષ્ય ઘરોનું વીજબીલ ઘટાડવાનું છે. સોલર રૂફ્ટોપ માટે અરજી પ્રક્રિયાને સરળ બનાવાઈ છે. લોકો વિજબીલની સાથે અરજી કરી શકે છે. રૂફ્ટોપ સોલરનો ઇન્સ્ટોલેશન રિપોર્ટ જમા થયાના 30 દિવસના અંદર અરજીકર્તાના બેન્ક ખાતામાં સબસિડી (1-3 કિલોવોટ સિસ્ટમ માટે રૂ.18,0000 પ્રતિ કિલોવોટ) આવી જાય છે. સૌર ઊર્જા, દેશમાં હરિત ઊર્જાની દિશામાં પરિવર્તનનો નવો ઈતિહાસ લખી શકે છે. જોકે, આગળનો માર્ગ પડકારજનક છે.

20માં ઈલેક્ટ્રિક પાવર સરવે અનુસાર,

2030 સુધી ભારતમાં ઘરેલું વીજણીની માગ બમણી થવાની અપેક્ષા છે. કાઉન્સિલ ઓન અનર્જી, એનવાયનમેન્ટ એન્ડ વોટર (સીઈઈડબલ્યુ)ના તાજેતરના અભ્યાસ મુજબ, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 25 કરોડ ઘરની છત પર 637 ગીગાવોટ રૂફ્ટોપ સોલર લગાવવાની ક્ષમતા છે. આ તકનીકી ક્ષમતાના માત્ર એક તૃતીયાંશ રૂફ્ટોપ સોલરથી ભારતની ઘરેલું ઊર્જાની માગ (લગભગ 310 અબજ કિલોવોટ અવર) પૂરી થઈ શકે છે. રાજ્યસ્થાન, કર્ણાટક, ગુજરાત જેવા કેટલાંક રાજ્યો સુધી ફેલાયેલી યુટિલિટી સ્કેલ સૌર ઊર્જા ઉત્પાદનથી વિરુદ્ધ રૂફ્ટોપ સોલરની ક્ષમતા સમગ્ર દેશમાં હાજર છે. રૂફ્ટોપ સોલરથી વપરાશકાર ઊર્જામાં આભનિર્ભર બની શકે છે. આ સિવાય તે વધારાની પેઢા થયેલી વીજણી, વિદ્યુત વિતરણ કંપનીઓ (ડિસ્કોમ)ને વેચીને કમાણી પણ કરી શકે છે. રૂફ્ટોપ સોલરથી એક જ સ્થાને સૌર ઊર્જાનો વપરાશ અને ઉત્પાદન થાય છે, એટલે તેનાથી પાવર ગ્રિડ પર દબાણ

ઘટાડવામાં પણ મદદ મળે છે. સીઈઈડબલ્યુના અભ્યાસનું અનુમાન છે કે, બિહાર અને મેધાલયમાં ગ્રામીણ ઘરો પર રૂફ્ટોપ સોલર લગાવવાથી ડિસ્કોમને પ્રતિ 100 મેગાવોટ સૌર ઊર્જા ક્ષમતા પર રૂ.2,700 કરોડની બચત થઈ શકે છે. આપણે ત્રણ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. પ્રથમ- એક કિલોવોટથી નાના રૂફ્ટોપ સોલર સિસ્ટમ માટે સબસિડી શરૂ કરવામાં આવે. અમારા વિશ્વેષણમાં જાણવા મળ્યું કે, નીચેના સ્લેબમાં વીજણીની ઓછી માગને કારણે 50 ગીગાવોટ રૂફ્ટોપ સોલરની ક્ષમતા 1 કિલોવોટથી ઓછી શ્રેણીમાં છે. જોકે, વર્તમાન નિયમ 1 કિલોવોટથી ઓછા રૂફ્ટોપ સોલરને માન્યતા આપતો નથી. અને સબસિડી લાગુ થતી નથી. આ વર્ગમાં સબસિડીથી ગ્રામીણ વિસ્તારોમાં રૂફ્ટોપ સોલર અપનાવવાનો દર વધશે.

બીજું- રૂફ્ટોપ સોલરની માગમાં તેજ માટે રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે. સીઈઈડબલ્યુનું

અનુમાન છે કે, દેશમાં માત્ર 5% ઘરેલું વીજ વપરાશકારોએ રૂફ્ટોપ સોલરની ઈચ્છા બતાવી છે. ટેક્નોલોજી, તેના ફાયદા, સબસિડી અને મીટરિંગ માટે ડિસ્કોમની પ્રક્રિયાઓ સંબંધિત જાગૃતિ જરૂરી છે. રાજ્યોએ પણ રૂફ્ટોપ સોલર, સરકારી યોજનાઓ, વર્ચ્યુઅલ/ફિઝિકલ સિસ્ટમ દૂર અને સબસિડી/લોન કેલ્ક્યુલેટર અંગે મૂળભૂત, વિશ્વસનીય અને આકર્ષક માહિતી પૂરી પાડવા એક સમર્પિત પોર્ટલ બનાવવું જોઈએ.

ત્રીજું- સૌર ઊર્જાના પારંપરિક મોડલ્સથી આગળ વધવું જોઈએ. મોટાભાગના ઘરેલું વીજ વપરાશકારો માટે નાણાકીય મદદ વગર રૂફ્ટોપ સોલર ફિટ કરવું સહેલું હોતું નથી. ધાબાનો માલિકી અધિકાર, મૂડીનો અભાવ, જુદી-જુદી માગણીઓ જેવા અવરોધો દૂર કરવા માટે કમ્પ્યુનિટી સોલર અને સોલર પાર્ટનર જેવા નવા મોડલ્સના નિયમોની જરૂર છે. (આ લેખના સહલેખક નીરજ કુલદીપ છે)